

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ફ્રી ફેર્સ (ભાડા વગર), રીયર બોર્ડિંગ (બસમાં પાછળના ભાગેથી પ્રવેશવું), હાફ કેપેસિટી (અડધી બેઠક ક્ષમતાની) બસો અને ઘણું બધું માર્ચ 21 અને માર્ચ 23 નાં રોજ રજૂ કરશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 20, 2020) – આજે, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ઘોષણા કરી કે COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી શનિવાર, માર્ચ 21 થી શરૂ કરીને, ભાડું ચૂકવવું જરૂરી બનતું નથી, ગ્રાહકો માત્ર રીયર ડોર્સ (પાછળના ભાગના દરવાજાઓ) મારફતે બસમાં પ્રવેશી શકશે. રેમ્પનો ઉપયોગ કરવો અનિવાર્ય હોય તેવા એક્સેસિબિલિટીની જરૂરિયાતો ધરાવતા ગ્રાહકો ફ્રી ડોર્સનો (આગળના દરવાજાઓનો) ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે.

સોમવાર, માર્ચ 23 થી શરૂ કરીને અને આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી, નીચેના ફેરફારો પણ અમલી બનશે:

- સોમવાર-શુક્રવાર માટે શનિવારની વધારે સારી સર્વિસ. વિગતો [અહીં](#) જોઈ શકાય છે.
- શનિવાર અને રવિવારની સર્વિસ પોતાના નિયમિત સમયપત્રકો પ્રમાણે ચાલુ રહેશે.
- બ્રેમ્પટન ટ્રાન્ઝિટની 185 ક્લાર્ક બુલેવર્ડ અને 130 સેન્ડલવૂડ પાર્કવે વેસ્ટ સ્થિત એડમિનિસ્ટ્રેટિવ ઓફિસીસ (વહીવટી કાર્યાલયો) જાહેર જનતા માટે બંધ રહેશે. આ સમયે કોઈ ભાડું ચૂકવવું જરૂરી ન હોવાને લીધે, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ આપેલા તમામ સીનિયર આઈડી કાર્ડ્સ, વેટેરન્સ કાર્ડ્સ અને PRESTO (પ્રેસ્ટો) સેલ્સ સ્થગિત કરવામાં આવ્યા છે. ખોવાયેલી અને મળેલી વસ્તુઓ સંબંધિત પૂછપરછો માટે, ગ્રાહકો 905.874.2750 એક્સ્ટેન્શન 62732 નંબર પર કોલ કરી શકે છે.

સમુદાયમાં COVID-19 નો ફેલાવો ઘટાડવા, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ માર્ચ 23 નાં રોજ નીચેની બાબતો પણ અમલમાં મૂકશે:

- બસ પર ઉતારુઓની ભાર ક્ષમતા અડધી બેઠકની કરવામાં આવશે જેથી ઉતારુઓ વચ્ચે સામાજિક અંતર જાળવવાના આચરણોને ટેકો મળી રહે. આનો અર્થ એ થાય કે એકવાર બસો અડધી ભરાઈ જાય એટલે, સ્ટોપ્સ જતા કરવામાં આવશે અને કેટલાક ઉતારુઓ પાછળ રહી જાય તેવું બની શકે. બાકીના ઉતારુઓને લઈ જવા વધારાની બસ ઉપયોગમાં લેવા દરેક પ્રયત્ન કરવામાં આવશે.
- બહુ વ્યસ્ત રૂટ્સ પર, ઉતારુઓ બસમાં હોય તે વખતે તેઓ વચ્ચે સામાજિક અંતર જાળવવા ઉતારુઓની ક્ષમતામાં સહાયરૂપ થવા આર્ટિક્યુલેટેડ બસો મૂકવામાં આવશે. આનો અર્થ એ થાય કે Züm (ઝુમ) આર્ટિક્યુલેટેડ બસો નિયમિત રૂટ્સ પર જોવામાં આવી શકે. કૃપા કરી બસો પરના ડેસ્ટિનેશન (નિર્ધારિત સ્થળ) ચિહ્નો પર ધ્યાન આપશો.
- બસ પર કર્મચારીઓ સહિતની દરેક વ્યક્તિ વચ્ચે પૂરતું અંતર હોવાની ખાતરી કરવા, બેઠકોને પીળી ટેપથી ઓળખવામાં આવશે અને ઉતારુઓને આ બેઠકો પર ન બેસવાનું કહેવામાં આવશે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ટર્મિનલ્સ અને તેનું સંપર્ક કેન્દ્ર આ સમયે નિયમિત સંચાલન કલાકો જાળવશે. સંચાલન કલાકોમાં કોઈ ફેરફારનો સંવાદ વેબસાઈટ www.bramptontransit.com પર કરવામાં આવશે.

વધારે સારી સફાઈ અને ચેપનાશક સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને ચેપરહિત કરવામાં આવશે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવા, અને પોતાના હાથ અવારનવાર ધોવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેજર્સ ઓફિસમાંના પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ટપણે કામ કરી રહ્યું છે. અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/covid19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો.

અવતરણો (ક્વોટ્સ):

“અમે એ ખાતરી કરાવવા કટિબદ્ધ છીએ કે આ અસાધારણ સમય દરમિયાન બ્રેમ્પટન આરોગ્યપ્રદ અને સુરક્ષિત શહેર રહે, અને અમે જોકે ફી ફેર (ભાડા વગર), રીયર બોર્ડિંગ (બસમાં પાછળના ભાગેથી પ્રવેશવું) અને હાફ કેપેસિટી (અડધી બેઠક ક્ષમતાની) બસોનું અમલીકરણ કરી રહ્યાં છીએ. બ્રેમ્પટન ટ્રાન્ઝિટ એક નિર્ણાયક સેવા છે જેનાથી ઘણાં રહેવાસીઓ જરૂરિયાતોને પહોંચી વળે છે, અને અમે તેની એક્સેસિબિલિટીને સમર્પિત છીએ. અમારા ભાગીદારો સાથે મળીને, અમે COVID-19 નો પ્રભાવ સૌથી ઓછો કરવા કટિબદ્ધ છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટન અમારા ટ્રાન્ઝિટ ઓપરેટરોની સતત સુરક્ષા ચાલુ રહેવાની ખાતરી કરે છે ત્યારે અમે બ્રેમ્પટન રહેવાસીઓ માટે સુરક્ષિત પરિવહન તકો પૂરી પાડવા કટિબદ્ધ છીએ. અમારી સેવાઓ જાળવી રાખવા, આજની ઘોષણા ખાતરી કરાવે છે કે અમે આ પડકારભર્યા સમય દરમિયાન સુરક્ષાને મોખરાનું સ્થાન આપીને તેને કેન્દ્રમાં રાખીને ચાલુ રાખી રહ્યાં છીએ.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca